


# માનસિક સ્વાસ્થ્ય અને આપણે



મગજ અને  
માનસિક રોગ  
અંગેની  
માહિતી આપતુ  
ત્રિમાસીક  
મેગેઝીન

તંત્રી : ડૉ. આઈ. જે. રત્નાણી

Vol : 2 Issue : 2      Quarterly      Price Rs.12/-  
April - June, 2018      BHAVNAGAR

[www.psychiatristonline.blogspot.com](http://www.psychiatristonline.blogspot.com)      /DocRatnani  
 [drijratnani@gmail.com](mailto:drijratnani@gmail.com)      9925056695

## અનુકમણીકા

૧. તંત્રી સ્થાને થી	૩
૨. શું માનસિક બિમારી એ આપદાતનું કારણ બને છે ?	૫
૩. Schizophrenia સ્કિડોફેનિયા (સથિત)	૮
૪. Re - wire your Brain (Part-2)	૧૧
૫. પ્રશ્નતી પછીની માનસિક બિમારી - પોસ્ટ પાર્ટમ સાચકોસીસ	૧૪
૬. વાચકોના પ્રશ્નો	૧૮

## Disclaimer

- ➡ અતે ચર્ચેલ રોગ, નિદાન અને સારવાર અંગેની સુચનાઓ માત્ર પ્રાથમિક સમજણ માટે છે. દર્દીના લક્ષણો, દવાની અસરો વગેરે દર્દીની તાસીર મુજબ હોઈ સારવાર માટે નિષ્ણાત તબીબનો અભિપ્રાય અનિવાર્ય છે.
- ➡ અતે દર્શાવેલ સુચનાઓને ડોક્ટરનો અભિપ્રાય માની લેવો નહીં.
- ➡ આ મેગેઝીન મગજ અને માનસિક રોગની જાગૃતી લાવવાનાં શુભ હેતુથી શરૂ કરેલ છે. આપના વાંચન બાદ અન્યોને વાંચવા આપી જન જાગૃતી અભીયાનમાં સહભાગી બનનું.
- ➡ મેગેઝીનમાં ચર્ચેલ કેસોમાં દર્શાવેલ દર્દીના નામો બદલીને લખેલ છે.

## તંત્રી સ્થાને થી.....



**“માનસિક સ્વાસ્થ્ય અને આપણો”**

મેગેઝીનના આ અંકમાં આપણો માનસિક રોગો અંગે પદ્ધુ ચર્ચા કરીશું. દરેક અંકની માફક આ અંકમાં પણ એક માનસિક બિમારીનું સચિત્ર નિરૂપણ કરીશું. આ અંકમાં સ્કિઓફેનીચા નામની માનસિક બિમારીની સચિત્ર ચર્ચા કરીશું. જેમાં અન્યો પર વ્હેમ, શંકા, કુશાંકા, એકલા એકલા બોલપુ - હસપુ, અદ્રશ્ય અવાજો સંભળાવા કે દ્રશ્યો દેખાવા જેવા ચિનહો મુખ્ય હોય છે. આ બિમારીના દર્દીઓ પોતે કોઈ બિમાર હોવાનું અને સારવાર જરૂરી હોવાનું માનતા જ નથી. જો આ બિમારીને નજીકના સ્નેહીઓ - મિત્રો શરૂઆતમાં જ ઓળખી યોગ્ય સારવાર શરૂ કરે તો દર્દીનું ઝુવન બદલી શકાય છે.

**વડોદરાના મનોચિકિત્સક અને સાચકોથેરાપિસ્ટ ડૉ. ઈલાબેન શર્માના અર્ટિકલ Rewire Your Brain Part 2 દ્વારા “આપણો આપણા વિચારોને બદલીને જાણો મગજની રચના અને કાર્યો બદલી શકીયે છીએ” ભાગ ૨ માં વિચારોને બદલવાની પાંચ પદ્ધતીઓની ચર્ચા કરીશું.**

આશરે ૧૦% ૧૨% સ્ત્રીઓમાં પ્રસુતી પણી સાચકોસીસ કે ડિપ્રેશનની માનસિક બિમારી જેવા ભણે છે. જેની સમયસર નિદાન અને સારવાર નવજાત શિશુ તથા માતા માટે જરૂરી છે, “પોસ્ટ પાર્ટમ સાચકોસીસ” તરીકે ઓળખાતી બિમારીની ચર્ચા આપણો આ અંકમાં કરીશું.

વિશ્વમાં દર વર્ષે આઠ લાખ લોકો આપદાતથી મૃત્યુને બેટે છે જે પૈકી ૧૭% (આશરે ૧.૩૫ લાખ મૃત્યુ) તો એકલા ભારતમાંથી નોંધાય છે. ૧૫ થી ૨૪ વર્ષના ચુવાનોમાં આપદાતાએ મૃત્યુનું પ્રથમ કારણ છે. (સ્ત્રોત: વિશ્વ આરોગ્ય સંસ્થા). આ અંકમાં આપણે માનસિક બિમારી અને આપદાતાનો શો સબંધ છે. તેની ચર્ચા કરીશું. ઉપરાંત જો આપના સ્નેહીજન કે મિત્રો આપદાતાની વાત કરે તો શા પગલા લેવા તેની ચર્ચા કરીશું.

એક વાચકે પુછેલ વાચથા નામની દવા જે ઈન્ડ્રીયના ઉત્તેજનાના અભાવની સારવારમાં વપરાય છે. તેની ચર્ચા કરીશું.

વોટ્સ એપ પર “માનસિક સ્વાસ્થ્ય અને આપણે” મેગેઝીનની સોફ્ટ કોપી દર ત્રણ મહીને નિયમીત મેળવવા માટે **9925056695** પર આપનું નામ અને અને વોટ્સ - એપ નંબર મોકલશો. તથા આ નંબર આપના ફોનમાં સેવ રાખો.

આભાર સહ ...

ડૉ. આઈ. જે. રત્નાણી,  
મગજ અને માનસિક રોગ નિષ્ણાત  
ભાવનગર, ૮૮૨૫૦૫૯૮૮૫  
E-Mail : [drijratnani@gmail.com](mailto:drijratnani@gmail.com)

## (માનસિક સ્વાસ્થ્ય અને આપણે)

મેગેઝીન નિયમીત મેળવવા માટે  
આપનું નામ, સરનામુ અને મોબાઇલ નં.  
 **9925056695** પર WhatsApp કરો.  
તથા ઉપરોક્ત નંબર આપના મોબાઇલમાં સેવ રાખો.

## ૨. શું માનસિક બિમારી એ આપદાતનું કારણ બને છે ?



આપદાતથી મૃત્યુ પામનાર ૬૦% વ્યક્તિઓ કોઈને કોઈ માનસિક બિમારીના દર્દીઓ હોય છે.

ડિપ્રેશનના ૧૫% સુધી દર્દીઓ આપદાતથી મૃત્યુ પામે છે.

બાયપોલર ડિસોર્ડર (ઉન્માદ અને ઉદાસીની ડ્રિધ્વીય બિમારી) ના ૨૦% સુધી દર્દીઓ આપદાતથી મૃત્યુ પામે છે.

સ્કિઝોફ્રેનિયાના ૧૫% સુધી દર્દીઓ આપદાતથી મૃત્યુ પામે છે.

જ્યારે દર્દીઓ ભવિષ્ય અંદરામય લાગવાની, કચાંક દુર જતા રહેવાની - ભાગી જવાની વાતો કરે તેઓમાં આપદાતનું જોખમ વધુ હોય છે.

ડિપ્રેશનની સારવાર શરૂ કર્યા બાદ શરૂઆતના તબક્કામાં પણ આપદાતનું જોખમ ઓછુ થતા સમય લાગે છે.

જેઓ અગાઉ આપદાતનો પ્રચાસ કરી ચુક્યા છે કે જેમના કોઈને કોઈ કુટુંબીજન (લોહીના સગા)નું આપદાત થી મૃત્યુ થયું છે, તેઓમાં આપદાતનું જોખમ વધુ રહે છે.

દર્દીનિ આપદાતના વિચારો અંગે પુછો (માર્ગ મનોચિકિત્સક)

જેઓ અગાઉ આપદાતનો પ્રચાસ કરી ચુક્યા છે કે જેમના કોઈ કુટુંબીજનનું આપદાતથી મૃત્યુ થયું છે, તેઓમાં આપદાતનું જોખમ વધુ રહે છે.

તરિકેના અનુભવ પ્રમાણે ઘણી વખત દર્દીનિ આપદાતના વિચારો બાબતે કંઈ પૂર્છા કરવાની કોશીશ કરતા જ, દર્દી પહેલા તેના નજીકના સગાઓ જ ના એવું કંઈ નથી, એમ તો વીલ પાવર સ્ટ્રોંગ છે વગેરે કહી વાત ટાળવાની કોશીશ કરતા હોય છે. અને બાદમાં વધુ પૂર્છા કરતા દર્દીએ પ્રકારના વિચારોનો સ્વીકાર કરે છે. દર્દીને તેના વિચારો પુછો... અને તેને વ્યક્ત કરવા દો... પોતાની માન્યતા અનુમાનોના આધારે ધારણા ન બાંધીલો.)

ડિપ્રેશન કે કોઈપણ માનસિક બિમારીની સારવારમાં આશરે એક થી દોઢ મહીનામાં લગભગ ઘણો સુધારો જોવા મળે છે. દર્દી લગભગ સાજે થઈ પૂર્વવત જીવતો થઈ જાય છે... પરંતુ આ સાથે દર્દીની સારવાર પૂર્ણ થતી નથી. દવાઓ અને સારવારનો કોર્સ વધુ

**દર્દીને આપદાતનાં વિચારો  
વિશે પુછો. આપદાતની વાત  
વ્યક્ત કરવા દો. દર્દીને પોતાના  
આપદાત ના વિચારો ની વાત  
કરતો અટકાવવાથી ઉલટાનું  
આપદાતનું જોખમ જાળવામાં  
થાપ ખાઈ જઈએ છે.**

લાંબો હોય છે (જો પ્રથમ વખત તકલીફ થયેલ હોય તો ક થી ક મહીના અને જો વધુ જુની બિમારી હોય તો તે અનુસાર વધુ લાંબો સમય) દર્દી પોતાની સારવારનો કોર્સ પૂર્ણ કરે તે ખુબજ જરૂરી છે. છેલ્લા એક - બે દાયકાઓમાં

માનસિક બિમારી અને સારવાર

અંગે જાગૃતી વધતા સારવાર માટે મનોચિકિત્સકનો સંપર્ક કરતા દર્દીઓનું પ્રમાણ વદ્યું છે, પરંતુ હવે મુખ્ય પ્રેરણ સારવાર પુરી થાય ત્યાં સુધી દવાઓ શરૂ રાખવાનો છે. વરચ્યે - વરચ્યે દવા વગર કેમ રહે છે ? એવું જોવા અખતરાઓ ન કરવા જોઈએ.

માનસિક રોગની સારવારમાં વપરાતી દવાઓની શરીરના અવયવો જેવા કે લીવર, કીડની, હદ્ય પર કોઈ ગંભીર આડ અસર

ડિપ્રેશન કે અન્ય માનસિક બિમારીની સારવાર માટે ઉપયોગમાં લેવાતી એલોપેથીક દવાઓ સલામત છે. તેનાથી શરીરનાં લીવર-કીડની કે અન્ય અવધવ ને જોખમ થવાની શક્યતા નથી.

નથી. એલોપેથી દવાઓનો ભય કે તેની ગેરમાન્યતાઓના લીધે દવાઓ શરૂ કરવાથી કરતા કે સારવાર અધ્યરી છોડતા દર્દીઓ પુષ્કળ છે. એલોપેથીનો વિરોધ કરતા સમયે આપણે આ દવાઓ ન લેવાથી થતા નુકશાન અને આપધાત જેવા જોખમને જાણો ગણતા જ નથી. માનસિક બિમારીની સારવારમાં અન્ય ભારતીય પદ્ધતિઓ દ્વારા કરવામાં આવતી સારવાર કે ધાર્મિક વિધીઓ ખાસ ઉપયોગી થતા નથી. ડિપ્રેશન કે અન્ય માનસિક બિમારીની સારવારમાં શરૂઆતના તબક્કામાં સારુ થતા જ દર્દી પોતાને જે દવાઓથી ફાયદો થયો હોય તે એલોપેથી દવા બંધ કરી અન્ય ચિકિત્સા પદ્ધતિઓ કે ધાર્મિક વિધીના પ્રયોગો શરૂ કરે છે. જે માનસિક બિમારી લાંબો સમય ચાલવાનું, પીડાનું, આપધાત જેવા પરિણામોનું અને સેંકડો માનવ કલાકો (કલાકો નહીં મહીનાઓ કે વર્ષો) ના વ્યયનું કારણ બને છે.

માત્ર ડિપ્રેશન કે અન્ય માનસિક બિમારીની ઓળખ કે નિદાન કરવાથી, દર્દીના આપધાત જેવા જોખમને ઓળખવાથી વાત પૂરી નથી થઈ જતી. સારવારમાં ફાયદો થયા બાદ પણ સારવાર લાંબો સમય તેનો કોર્સ પૂર્ણ ન થાય ત્યા સુધી શરૂ રાખવી ખુબ જરૂરી હોય છે. જેથી લાંબા ગાળાનું સ્વાસ્થ્ય, જીવન અને ભવિષ્ય સુરક્ષિત કરી શકીએ છીએ.

માત્ર આપધાતનાં જોખમને ઓળખી સારવાર શરૂ કરવાથી વાત પૂરી થઈ જતી નથી.  
સારવારથી ફાયદો થયા બાદ દવાનો કોર્સ પૂરો કરવાનો રહે છે.

\* \* \* \* \*

### 3. Schizophrenia સ્કિઝોફેનિયા (સંયિત્ર)

#### 1. ડિલુઝન (વ્હેમ - શંકા - કુશંકા)

- કુંદુંબીજનો, પાડોશીઓ મિત્રો મારા વિરોધીઓ છે.
- મારી વાતો કરે છે.
- મારા પર નજર રાખવામાં - જાસુસી કરવામાં આવે છે.
- મને મારી નાખવા માગે છે.
- ખોરાકમાં ઝેર ભેળવે છે.
- CID વાળા પીઠો કરે છે.



#### 2. હેલુઝીનેશન (વિલબમ)

- જાણે કોઈ અદૃશ્ય અવાજો સંભળાય કે દ્રષ્ટ્યો દેખાય કે સંવેદનાઓ થાય. (જે ખરેખર અસ્તિત્વ ધરાવતુન હોય)
- જાણે પોતાના વિરુદ્ધ કાવતરુ કરતા બે માણસોની વાતો સંભળાય.



### 3. અસામાન્ય વર્તન

- એકલા બેસી રહેવું.
- એકલા - એકલા બોલવું, હસવું, ઇશારાઓ કરવાં, બબડવું.
- નકામી વસ્તુઓ, કાગળ, કચરો, પુછા ભેગા કરવાં.
- દિવસો કે મહીનાઓ સુધી નહાવુનાઈં.
- વાળ ના ઓળવા, દાઢી ના કરવી.



### ૪. ચાદ શક્તિ

- વૈચારિક શક્તિ ઘટવી
- અન્યો સાથે સબંધો
- જળવી ના શકે
- લાગણીહીન બની જાય
- છેદા તબક્કા સુધી જે સારવાર ના થઈ શકે તો દર્દી રસ્તે રજણતી પાગલ જેવી હાલત સુધી પહોંચી શકે છે.



## સારવાર

### દવાઓ....

- લગભગ એકથી દોડ મહીનામાં સુંદર પરીણામ
- કોર્સ ૮ થી ૧૨ મહીના શરૂ રાખવો.
- દર્દી ફરીથી નોર્મલ જુંગની જીવતો થાય અને કામ કાજ પર ધ્યાન આપી શકે તે જોવું.
- સારવારથી ફાયદો થચા બાદ પણ કોર્સ પૂર્ણ કરવો જરૂરી.



\* \* \* \* \*

**You**  
**Tube**

Videos

મગજ, માનસિક રોગ અને સેકસ સમસ્યાઓ અંગેના  
ગુજરાતી તથા હિન્દી ભાષામાં વિડીયોઝ -  
ચુટ્યુબ ચેનલ

Subscribe on Dr. I. J. Ratnani Psychiatrist

## 4. Re-wire your Brain (Part-2)

### Dr. Elavatsala Sharma

Psychiatrist & Psychotherapist

- B.A.P.S Hospital, Vadodara
- 📞 9925012454
- ✉️ drvatsalaela@gmail.com



**So continuing it further to Re-wire your brain, there are five pathways that need to be stimulated.**

**The five areas that need to be stimulated are your beliefs, feelings, vision, actions and repetition.**

Let us use an example of personal perception. Imagine we want to change a perception of low self-esteem or self-worth into one of good self-esteem or high self-worth. Using affirmations on their own to increase a feeling of self-worth is often not enough. We need to stimulate all five areas.

Here's how we can increase the feeling of positivity toward ourselves:

**1. Identify the beliefs that achieve this state.** You need to understand what beliefs need to change or be present in order to fulfil your intention. What do you need to believe about yourself? That you're capable? That you're smart? Funny? Kind? Caring? Driven? Motivated? Anything you want. You need to work out what beliefs you want to have about yourself and hold them in your mind. It's ok if you're not 100% convinced at the start. In fact, it doesn't matter if you're not even 10% convinced yet. Identify them, and hold on to them.



**2. Stimulate positive emotions.** Emotions play a huge role in cementing a belief into your mind. Repeating a positive thought, affirmation or mantra without feeling anything will achieve

nothing. You need to align a positive state with positive emotions. What positive emotions correlate with your desired beliefs? Will you feel proud, happy, content, calm or strong? Invoke these feelings as you think about your beliefs, by imagining how you will feel in that desired state.

**3. Use visual cues.** Your brain can't tell the difference between something real and imagined. By teaming visualization with belief, your brain accepts this as reality. Use imagery to back up your emotions and desired beliefs. Find pictures that align with what you want to achieve, and invest time visualizing them every day. Try a combination of mental imagery and physical pictures.

Mental imagery may be seeing you smiling or laughing, healthy, full of confidence and strength. Run a little picture of that over in your mind while feeling those chosen emotions. Physical pictures might include looking at what this desired state will bring to you. It might be something as simple as a person sitting in a chair in a beautiful garden. It might be a person enjoying something you've always wanted to do, like singing. The key with this technique is to imagine you as that person. You have to imagine it's you. Imagine how you would feel in that moment.

**4. Take actions that align with your intention.** You actions have to be in line with your goals and what you are aiming to achieve. You cannot use belief and imagery to see yourself as a confident and happy person, and then say the opposite through your actions. Actions of self-esteem are doing things that nurture your body and yourself. This could be anything from exercise that you enjoy, spending time with people who lift you up, eating and drinking foods that make you physically feel great. Any negative action; harming or starving yourself, spending time with negative people or not taking care of your body will undo all of your work. Treat yourself well.

**5. Repeat, repeat, repeat.** The more we fire up a neurological network, the stronger the pathway is. Repetition of these steps will create a strong and lasting thought pattern. It will become easier and easier, and eventually automatic. Over time, you will literally rewire your brain into accepting this new belief or new habit. It's not hard, but it can be tough, at least at the start. The more often you do it, the easier it will become.

It doesn't have to be a morning ritual only. Focusing on this for five minutes in the morning forgetting about it for the rest of the day will take longer for it to 'stick'. Instead, run through this process whenever the thought pattern you are trying to eradicate comes up. This series of steps can be run through in just a few minutes or even seconds if you want it to.

Keep it fresh and at the top of your mind until it is an automatic habit.

Think of a belief you want to re-wire in your brain and try this technique out.

\* \* \* \* \*

## પ. પ્રસુતી પણીની માનસિક બિમારી - પોષ્ટ પાર્ટમ સાચકોશીસ



અંજલીને પુત્ર અવતરતા  
આજો પરીવાર પુત્ર  
જન્મની ખુશી મનાવી રહ્યો  
હતો પરંતુ કોણ જાણો  
અંજલી ખુશ ના હતી.  
અંજલી ના લગ્નના ત્રણ

વર્ષ બાદ પુત્ર જન્મ થયો હતો. અને સુવાવડ પણ શહેરના નામાંકિત સ્ત્રી રોગ નિષ્ણાત ડોકટરે કરી હતી. તેણીની ગર્ભાવસ્થા અને પ્રસુતી નિર્વિધને પુર્ણ થયા હતા. પ્રસુતીના એકાદ - બે દિવસમાં ડોકટરે હોસ્પિટલમાંથી રજ આપી હતી.

એકાદ અઠવાડીયામાં અંજલીની તકલીફો ઘણી વધી જાય છે. તે વાત વાતમાં અત્યંત લાગણીશીલ થઈ રહવા લાગે છે. રાતે સુતી જ નથી કે કયારેક એકાદ - બે કલાકમાં જ જાગી જાય છે. નાની નાની વાતમાં ઉશકેરાઈ જાય છે. પોતાના બાળકની સંભાળ પણ રાખતી નથી. બાળકને સમયસર ધાવણ આપતી નથી. તેને સતત કોઈ ભય રહ્યા કરે છે કે તેને અને બાળકને જોખમ છે. કોઈ તેઓને હેરાન કરવા કે મારી નાખવા

૧૦ થી ૧૨% સ્ત્રીઓમાં પ્રસુતી  
પણી સાચકોશીસ કે ડિપ્રેશનની  
તકલીફ જોવા મળે છે.

માગે છે. અંજલી એક ભિન્નિટ માટે  
પણ બાળકને પોતાનાથી દુર  
રાખી શકતી નથી, અરે પતિ કે  
સાસુ પણ બાળકને રમાડવા

માગે તો વિરોધ કરે છે. અત્યંત ઉશકેરાઈ જાય છે. અને રડવા લાગે છે કે તેઓ પોતાના બાળકના દુશમન છે. તેઓ બાળકને બદલી નાખવાના કે નુકશાન પહોંચાડવાના હેતુથી બાળકને રમાડવાનું નાટક કરી રહ્યા છે.

અંજલીની દેનિક કિયાઓ પણ હવે નિયમીત રહી નથી. સમયસર જમતી નથી, કયારેક એકલા - એકલા બોલ્યા કે બબડ્યા કરે છે, ઈશારાઓ કર્યા કરે છે. આ

દરમિયાન અંજલીના સગા સંબંધીઓ અંજલી કોઈ ટૈપ્પી શક્તિના કે મેલી વિધાના પ્રભાવમાં હોવાની શંકા કરે છે અને એકાદ અઠવાડીયા વિવિધ વિધીઓ અને દોરા - તાવીજ વડે તેનો ઈલાજ કરવાની કોશીશ કરવામાં આવે છે પરંતુ પરિણામ શુન્ય રહે છે.

આખરે કોઈ હિતેચ્છની સલાહ મુજબ અંજલીને મનોચિકિત્સક પાસે સારવાર અર્થે લાવવામાં આવે છે. અંજલીને હકીકતમાં “પોસ્ટ પાર્ટમ સાયકોસીસ” નામથી ઓળખાતી પ્રસુતી પણી થતી માનસિક બિમારી થઈ છે. આશારે ૧૦ થી ૧૨% સ્ત્રીઓમાં પ્રસુતી પણી સાયકોસીસ (હેમ - શંકા કે અન્યો હેરાન કરવા કે મારી નાખવા માગે છે. એકલા - એકલા બોલવું, બબડવું, હસવું ઈશારા કરવા જેવા લક્ષણો) કે ડિપ્રેશન (ઉદાસી, ખાલીપો, ચિકિયાપણું, નિરસતા, અનિદ્રા, ખોરાક પ્રત્યે અરૂઢી,

માનસિક તણાવ કે ગ્રાસ કયારેક  
માનસિક બિમારીની શરૂઆતનું  
કારણ બને છે. પરંતુ માનસિક  
બિમારીનું કારણ નથી. માનસિક  
બિમારીનું કારણ મગજના  
ન્યૂરોફાન્સિટર માં થતા ફેરફારો છે.

માનસિક બિમારીની વૈજ્ઞાનિક સારવાર  
કડપથી શરૂઆતના તબક્કામાં  
કરાવવાથી ભુંદર પરીણામ મળે છે.  
બીજી જરૂરી દોગા-ધાગા-તાવીજ-મેલી વિધા  
-તાંત્રીક-દૈવી શક્તિની વિધીઓ માં સમય  
વેકફિયાથી પરિસ્થિતી બગડે છે.

અપરાધભાવ, આપદાતના  
વિચારો વગેરે લક્ષણો) ની  
તકલીફ જેવા મળે છે.

આ બિમારીનું કારણ  
ગર્ભાવસ્થા અને પ્રસુતી  
સમયે સ્ત્રીના શરીરમાં થતા  
હોર્મોન ના ફેરફારોને લીધે થતા

મગજના ન્યુરોટ્રાન્સમીટર ના પ્રમાણમાં થતા ફેરફારો છે. ઘણા  
કેસોમાં પ્રસુતી પછીની માનસિક બિમારીને સાસરી પક્ષના લોકો  
સાથેના સંદર્ભ પછીની કે કોઈ માનસિક ત્રાસ ના કારણે હોવાનું  
માની લોકો બિનજરૂરી આક્ષેપો - પ્રતિઆક્ષેપો કરી સબંધોને  
બગાડવાનું કાર્ય કરે છે. તણાવ કયારેક માનસિક બિમારીની  
શરૂઆત થવાનું કારણ બને છે પરંતુ તણાવ એ માનસિક બિમારીનું  
એકમાત્ર કારણ નથી. માનસિક બિમારીનું કારણ જૈવિક છે. જેવી  
રીતે ઈન્સ્ટ્રુલીન નામના અંતઃસ્ત્રાવની ઉણાપ એ ડાયાબીટીસ  
નામની બિમારીનું કારણ છે. એવી જ રીતે ડોપામીન, સિરોટોનીન,  
નોર - એપીનેક્ઝીન નામના અંતઃસ્ત્રાવોની ઉણાપ એ ડિપ્રેશન અને  
સાયકોસીસ જેવી માનસિક બિમારીનું કારણ છે.

સામાન્ય રીતે પ્રસુતી પછીની માનસિક બિમારીઓ જેવી કે  
ડિપ્રેશન કે સાયકોસીસની સારવાર દવાઓ કે કેટલાક જટીલ  
કેસોમાં દાખલ કરી શેક વડે કરવામાં આવે છે. આવા સંજોગોમાં  
દર્દીની સતત દેખરેખ રાખવી, દર્દી પોતાની બિમારીના લીધે

પોતાની જાતને, બાળકને કે અન્યોને હાની ના પહોંચાડી દે તેનું ધ્યાન રાખવું પણ જરૂરી બને છે. કેટલાક કિસ્સાઓમાં જો દર્દી બાળકને ઈજા પહોંચાડશે તેવો ભય જણાય તો બાળકને માતાથી થોડો સમય દુર રાખવાની પણ સલાહ આપવામાં આવે છે. તદૃષ્પરાંત માતા સમયસર બાળકને ધાવણ આપે તે પણ એટલું જ જરૂરી છે.

સામાન્ય રીતે સધન સારવાર વડે બેથી ત્ર એ અઠવાડીયામાં દર્દીની સ્થિતી સુધરે છે. દર્દીની આપવામાં આવતી દવાઓ જુ જ કેસમાંજ ધાવણ મારફતે બાળકના શરીરમાં જતી હોય છે. આથી બાળક પર દવાઓની કોઈ આડ અસર થવાનો અવકાશ નથી. જો કે સાજ થયા બાદ છ થી આઠ મહીનાની દવાઓનો કોર્સ પુરો કરવાનો રહે છે.

સારવાર શરૂ કરતા એકાદ-બે મહીનામાં લગભગ સત્ત્ર થઈ જાય છે. છતાં કોર્સ પૂર્ણ કરવો જરૂરી છે. અધૂરો કોર્સ ભવિષ્યમાં માનસિક બિમારીનું જોખમ વધારે છે.

\* \* \* \* \*

વાયકોના પ્રશ્નો  
શોલમ માટે આપ પણ  
આપના પ્રશ્નો  
પૂરી શકો છો.

ડૉ. આઈ. જે. રત્નાણી

મગજ અને માનસિક રોગ નિષ્ણાત

9925056695

drijratnani@gmail.com

## ૬. વાયગ્રા પ્રેણો

**Q. વાયગ્રા - જે ઈન્જિયની ઉતેજના ના અભાવ (નપુંસકતા)ની સારવારમાં ઉપયોગી છે તેના વિશે માહિતી આપશો.**

**ANS :** ઈ. સ. ૧૮૮૮ માં અમેરિકાની ફાઈઝ કંપનીએ નપુંસકતા કે ઈન્જિયમાં ઉતેજનાનો અભાવ જેવી તકલીફની સારવાર માટે “સિડેનાફીલ” નામની દવા વાયગ્રા નામથી બજારમાં મુકી. ઘણા દર્દીઓ આ દવા જાતે જ ખરીદી તેનું સેવન કરે છે.

ઘણા જોકસ અને ફિલ્મોમાં તેના અતિશયોક્તિભર્યા નિરૂપણથી દર્દીઓ જાણે આ દવા એક રામબાળ ઈતાજ છે તેમ જોતા અને દવા પ્રત્યે અવાસ્તવિક અપેક્ષાઓ સેવતા થયા છે.

ચાલો આ દવા વિશે થોડી ઐઝાનિક ચર્ચા કરીએ.

૧. વાયગ્રા નપુંસકતાની સારવારમાં ઉપયોગી છે. પરંતુ વ્યક્તિને સેકસની ઈરછા થવી અને થોડી ઉતેજના અનુભવાવી આ માટે જરૂરી છે. આ થોડી ઉતેજનાને પુરી ઉતેજનામાં ફેરવવાનું કામ વાયગ્રાનું છે.

૨. વાયગ્રા સેકસની ઈરછા ના થવી કે શિધપતન જેવી તકલીફોમાં ઉપયોગી નથી. તેનાથી વ્યક્તિના સેકસ પાવરમાં વધારો થાય તે વાત પણ સાચી નથી

૩. જે દર્દીઓને હંદયરોગનો હુમલો આવી ગયેલ હોય કે બી. પી. ની સારવાર માટે “નાઇટ્રેટ” ગ્રુપની દવાઓ શરૂ હોય તેઓએ વાયગ્રાનો ઉપયોગ કરવો જોઈએ નહીં. બી. પી.માં અસાધારણ ઘટાડો થવાથી જીવનું જોખમ સંભવી શકે છે.

૪. “અમાઈલ નાઇટ્રેટ” ના વ્યસનીઓએ વાયગ્રાનો ઉપયોગ ટાળવો.

## મગજ અને માનસિક રોગોના પ્રકાર અને તક્ષણો

- માથાનો દુઃખાવો, માઈશેન, આધાશીશી
- ડિપ્રેશન, ઉદાસી, યિંતા, ગભરાટ, બેચેની
- પેટમાં ગેસ-વાયુ - અપચો
- ફેર-ચક્કર, કારણ વગર ડર લાગવો
- શરીરના જુદા-જુદા ભાગોમાં થતા દુઃખાવા
- આંચકી, વાઈ હિસ્ટેરીયા
- સ્કિઝોફેનિયા, ઉનમાદ (મેનિયા) તથા સ્મૃતિભંશ (ડેમેન્શિયા)
- અનિદ્રા, વિચારવાયુ, ધૂનરોગ
- સેકસ સમસ્યા
- બાળકો તથા તરણોનું પથારીમાં પેશાબ કરવું

**ડૉ. આઈ. જે. રત્નાણી**

MBBS, MD, PGDS, MIPS

મગજ અને માનસિક રોગ નિષ્ણાત

**ઓજસ ન્યુરોસાઇકિયાટ્રી ક્લિનિક**

સેકન્ડ ફ્લોર, શ્રી મહી પ્લાઝા, કાળુભા રોડ,  
કાળાનાળા, ભાવનગર- ૩૬૪૦૦૧

સમય સવારે ૧૧ થી ૧, સાંજે ૬ થી ૮

૭ 9978739359

RNI Registration No. GUJBIL/2017/73989


# MANSIK SVASTHYA ANE AAPANE

## માનસિક સ્વાસ્થ્ય અને આપણે

Printed Matter

Book-post

તરી  
**ડૉ. આઈ. એ. રચનાથી**  
 માગજ અને માનસિક રોગ નિષ્ટાત  
 શ્રી ભાગી પ્રાંત, કાળુલા રોડ,  
 કાળાનગર, લાખનગર- ૩૬૪૦૦૧.  
**₹ ૬૬૯૮૭૩૬૩૫૬**



Print Published, Owned and Edited by I. J. RATNANI  
 Printed at Vanshika Forms, F-12, Sanghvi Plastic Compound, Tekari Chowk,  
 Ruvapari Road, Bhavnagar, Gujarat, India Pin-364001  
 Published at Bapu Mehta Street, Amba Chowk, Bhavnagar, Gujarat, India Pin-364001  
 Editor : I. J. RATNANI